



અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન

મહાનગર સેવા સદન, અમદાવાદ

બી.યુ.પરમીશન લોરાઈઝ મકાન

બુક નંબર : 196

પાના નંબર : 29

નગર વિકાસ ખાતુ

જોન : ૧૨

વોર્ડ : ૨૧/૧૦/૧૦

(ધી બોમ્બે પ્રોવીન્સીયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ, ૧૯૪૮ ના શીડ્યુલ 'એ' ના ચેપ્ટર ૧૨ ના રૂલ ૮૫/૧ તથા જી.ડી.સી.આર. ૭ મુજબ વાપરવાની પરવાનગી)

રેફરન્સ નંબર : BLNTR/E2/190514/CDR/A1925/RI/M

માલિકનું નામ : અમરેશ કી. પંચપતિ પાર્વતી અમરેશ કી. પંચપતિ

સરનામું : ૧૧, મદગુરુ હાઇવે, કી. પાર્વતી અમરેશ પાલક

જાવા નિર્માણ, અમદાવાદ

T.P.S. No. 113/2017 F.P. No. 57/1+74/1 S.P. No./Tena./Block No. (સાંચીસ)
R.S. No. 189/1+206/1 Block No. 'A'
Gamtal C.S. No. Sheet No.

(૧) સોસાયટી/એસોસીએશન : બી.યુ.પરમીશન (૨) બિલ્ડર/ડેવલપરનું નામ : -

સરનામું : અમરેશ કી. પંચપતિ અમરેશ કી. પંચપતિ

સરનામું : અમરેશ કી. પંચપતિ અમરેશ કી. પંચપતિ

સરનામું : અમરેશ કી. પંચપતિ અમરેશ કી. પંચપતિ

(૩) એન્જીનીયરનું નામ : રીહા કી. પંચપતિ (૪) આર્કિટેક્ટનું નામ : -

સરનામું : રીહા કી. પંચપતિ અમરેશ કી. પંચપતિ

લાયસન્સ નં : ER-0782100221R1 લાયસન્સ નં : -

(૫) સ્ટ્રક્ચરલ ડિઝાઇનરનું નામ : અમરેશ કી. પંચપતિ (૬) કલાર્ક ઓફ વર્કસનું નામ : રીહા કી. પંચપતિ

સરનામું : અમરેશ કી. પંચપતિ અમરેશ કી. પંચપતિ

લાયસન્સ નં : ER-0349206221R1 લાયસન્સ નં : CW-0559020618

શરતો :-

- (૧) જનરલ ડેવલપમેન્ટ કન્ટ્રોલ રેગ્યુલેશનના વિનિયમ નં. ૨૬ ની જોગવાઈ અનુસાર ઈમારતની સાથે જ, જાળવણી અને મરમત વખતે વખત કરવાની શરતે વપરાશનું પ્રમાણપત્ર આપવામાં આવે છે.
- (૨) પ્રવર્તનમાં અથવા જે તે સમયના કાયદા અન્વયે ભરવાના થતા કરવેરા ભરવાના રહેશે.
- (૩) ભવિષ્યમાં સદરહુ વિસ્તારની નગર રચના યોજના હેઠળ જમા કરવાવાની થતી નેટ ડીમાન્ડની રકમ, ડ્રેનેજ ચાર્જ તથા અન્ય ફી, ડીપોઝીટ જમા કરાવવાની રહેશે.
- (૪) વપરાશના હેતુમાં ફેરફાર કરતાં પહેલાં પૂર્વ મંજૂરી લેવાની રહેશે.
- (૫) આ બાંધકામનો વપરાશ પર્યાવરણને હાનિકારક અને ઉપદ્રવકારી ન થાય તેમજ આસ-પાસના વિસ્તાર અને વિસ્તારના રહીશોને અસુવિધારૂપ કે મુશ્કેલરૂપ ન થાય તે રીતે વપરાશ કરવાનો રહેશે.
- (૬) મંજૂર થયેલ બિલ્ડ-અપ, એફ. એસ. આઈ., હાઈટ, માઈન, પાર્કિંગ, કોમન પ્લોટ, ઓપન સ્પેસ વિગેરેમાં મંજૂરી વગર ફેરફાર કરી શકાશે નહીં.
- (૭) પાર્કિંગ માટે ખુલ્લી રાખેલ જગ્યાના ભેદભાવના માપ કે ઉપયોગમાં કોઈ ફેરફાર કરવાનો રહેશે નહીં.
- (૮) હાલે સ્થળ ઉપરના હયાત માઈન, સ્ટેરકેશ, લીફ્ટ, કોમન પ્લોટ વિગેરે જેવા સહિયારા વપરાશ માટે મંજૂર થયેલ પ્લાનમાં દર્શાવેલ તમામ ખુલ્લી જગ્યા કે બાંધકામવાળી જગ્યાના માપમાં કે ઉપયોગમાં કોઈ ફેરફાર કરવાનો રહેશે નહીં.
- (૯) આ પ્રમાણપત્રથી બાંધકામની તેમજ બાંધકામ માટે વપરાયેલ માલ-સામાનની ગુણવત્તા પ્રમાણીત કરવામાં આવતી નથી અને તે અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કોઈ જવાબદારી રહેતી નથી કે રહેશે નહીં.
- (૧૦) આ પ્રમાણપત્રથી બાંધકામના સ્ટ્રક્ચરલ સ્ટેબીલીટી કે સ્ટ્રક્ચરલ સ્ટ્રેન્થ ગુણવત્તા પ્રમાણીત કરવામાં આવતી નથી અને તે અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કોઈ જવાબદારી રહેતી નથી કે રહેશે નહીં.
- (૧૧) ઉપરના કોઈપણ શરતો નો ભંગ થયેથી આ વપરાશનું પ્રમાણપત્ર આપોઆપ રદ થયેલ ગણાશે અને તે માટે કોઈ અલગ નોટીસ આપવામાં આવશે નહીં તેમજ કાયદા મુજબ જરૂરી પગલાં ભરવામાં આવશે.

આપનું મંજૂર કરાવેલ બાંધકામ પૂર્ણ થયાની તારીખ : ૦૬/૦૩/૧૭ ની અરજી નં : -

BU/E2/1803/7/1097 ના સંબંધમાં જણાવવાનું કે,

ઉપરોક્ત રેફરન્સ નંબરથી મંજૂર થયેલ પ્લાનમાં દર્શાવ્યા મુજબનો ઉપયોગ કરવાની શરતે અને આપને આપવામાં આવેલ સદરહુ

બાંધકામ કરવાના આરંભ પ્રમાણપત્ર નં. ૦૨૩૨૬/૧૯૫૫/૧૧૨૫/૧૧/૧૧

તારીખ : ૦૮-૧૦-૨૦૧૪ માં જણાવેલ શરતો સંદર્ભે નીચે દર્શાવ્યા મુજબ સદરહુ બાંધકામને સાથેના કમ્પ્લીશન

પ્લાનમાં દર્શાવ્યા મુજબ વાપરવાની પરવાનગી આપવામાં આવે છે. કમ્પ્લીશન પ્લાન તથા બી. યુ. પરમીશનની લેમીનેટેડ

કોપી સ્થળ ઉપર ચોટાડવાની શરતે આ પરવાનગી આપવામાં આવે છે.

(૧) મંજૂર થયેલ ઉપયોગ :

માળ	ઉપયોગ	મંજૂર કરેલ વાંધકામનું ક્ષેત્રફળ (ચો.મી.)	વાસની સંખ્યા રહેણાંક બીન રહેણાંક
બીજું ભોંયર	-	-	-
પ્રથમ ભોંયર	-	-	-
હોલો પ્લીન્થ	-	-	-
ગ્રાઉન્ડ ફ્લોર	૨૬ હોલો	૬૮૦.૦૨	૧૨
પ્રથમ માળ	"	૬૮૦.૦૨	-
બીજો માળ	"	૪૪૪.૩૪	-
ત્રીજો માળ	-	-	-
ચોથો માળ	-	-	-
સ્ટેર કેપિન + વિક્ટ મશીન રૂમ	-	-	-
કુલ	-	૧૮૦૪.૩૮	૧૨

પાર્કિંગની જોગવાઈની વિગત તથા લોકેશન :

પ્રથમ ભોંયરામાં : મંજૂર થયેલ ૨૬ હોલો ૨૬ હોલો ૨૬ હોલો
બીજા ભોંયરામાં :
હોલો પ્લીન્થમાં :
સી.પી. માં :

મંડર ગ્રાઉન્ડ/ઓવરહેડ વોટર ટેંકની વિગત : કોમન પ્લોટની વિગત :
તથા લોકેશન : મંજૂર થયેલ ૨૬ હોલો ૨૬ હોલો ૨૬ હોલો
મંજૂર થયેલ ૨૬ હોલો ૨૬ હોલો ૨૬ હોલો
દરેક દિશાના માઈનની વિગત : ઉત્તર : દક્ષિણ : પૂર્વ : પશ્ચિમ :

મંજૂર થયેલ ૨૬ હોલો ૨૬ હોલો ૨૬ હોલો

ટા.રે.સબ.ઈ. ૦૨/૦૫/૧૭

(નામ : અમરેશ કી. પંચપતિ)

લેનારની સહી તથા વિગત : અમરેશ કી. પંચપતિ

ટા.રે.સબ.ઈ. ૨૧/૫/૧૭

(નામ : અમરેશ કી. પંચપતિ)

ટા.રે.સબ.ઈ. ૦૨/૦૫/૧૭

(નામ : અમરેશ કી. પંચપતિ)

ટા.રે.સબ.ઈ. ૦૨/૦૫/૧૭

(નામ : અમરેશ કી. પંચપતિ)

(નામ : અમરેશ કી. પંચપતિ)



અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન

મહાનગર સેવા સદન, અમદાવાદ

બી.યુ.પરમીશન લોરાઈઝ મકાન

બુક નંબર : 196

પાના નંબર : 28

નગર વિકાસ ખાતુ

ઓન જુલ (બી બોમ્બે પ્રોવીન્શીયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ, ૧૯૪૮ ના સીડ્યુલ 'એ' ના ચેપ્ટર ૧૨ ના ક્લૅઝ ૮/બ/૧ તથા જી.ડી.સી.આર. ૭ મુજબ વાપરવાની પરવાનગી)
વોર્ડ રાજીવ-હાઈવે સરનામું કી. ૩૩૮/૧૭ સદેવા / ચોલા ગામ, વિશાલનગર ચાંડી ઘાટ, નિશીદનગર, અમદાવાદ તારીખ : ૦૩/૦૬/૨૦૧૮

રેકૉર્ડ નંબર : BLNTR/E2/1905/4/GDR/A1926/R1/M

માલિકનું નામ : અરવિંદ હી. પ્રજાપતિ ધાર્દેશ કો. સો. ઇ. મલિક

સરનામું : 11. મદનુડ હોમ, કી. વાર્ડ ૨૦૧૮ ના પાલક

ગાંધી વિહાર, અમદાવાદ

T.P.S. No. 115-૩૩૮૨ F.P. No. ૬૪/૧૫૫૫ S.P. No./Tena./Block No. -

Rev. Village (સાલા) R.S. No. 189/1+206/1 Block No. "B"

Gamtal - C.S. No. - Sheet No. -

(૧) સોસાયટી/એસોસીયેશન : સુચિત સો. ઇ. મલિક (૨) બિલ્ડર/ડિવલપરનું નામ : -

સાચી સદેવા કો. સો. ઇ. મલિક

સરનામું : સુ. રાજીવ સરનામું : -

વા. અમદાવાદ કો. ૨. ૧૯

અમદાવાદ

(૩) એન્જીનીયરનું નામ : રોહિત હી. પ્રજાપતિ (૪) આર્કીટેક્ટનું નામ : -

૩. મદનુડ હોમ, ગાંધી વિહાર

લાયસન્સ નં ER-0782106221R લાયસન્સ નં -

(૫) સ્ટ્રક્ચરલ ડીઝાઇનરનું નામ : જયેશ કી. દેસાઈ (૬) કલાર્ક ઓફ વર્કસનું નામ : દેવેશ કી. પટેલ

૬૪. આસી (૨) વા. ૦૨. દા. ૧૨૮/૫ ૬. શિવજીવ દેસાઈ

લાયસન્સ નં SD-0349200221R લાયસન્સ નં CW-0559020418

શરતો :-

- (૧) જનરલ ડેવલપમેન્ટ કન્ટ્રોલ રેગ્યુલેશનના વિનિયમનં. ૨૬ની જોગવાઈ અનુસાર ઈમારતની સાચવણી, જાળવણી અને મરમત વખતે વખત કરવાની શરતે વપરાશનું પ્રમાણપત્ર આપવામાં આવે છે.
- (૨) પ્રવર્તનમાન અથવા જે તે સમયના કાયદા અન્વયે ભરવાના થતા કરવેરા ભરવાના રહેશે.
- (૩) ભવિષ્યમાં સદરહુ વિસ્તારની નગર રચના યોજના હેઠળ જમા કરવાવાની થતી નેટ ડીમાન્ડની રકમ, ડ્રેનેજ ચાર્જ તથા અન્ય ફી, ડીપોઝીટ જમા કરાવવાની રહેશે.
- (૪) વપરાશના હેતુમાં ફેરફાર કરતાં પહેલાં પૂર્વ મંજૂરી લેવાની રહેશે.
- (૫) આ બાંધકામની વપરાશ પર્થવરણને હાનીકારક અને ઉપદ્રવકારી ન થાય તેમજ આસ-પાસના વિસ્તાર અને વિસ્તારના રહીશોને અસુવિધારૂપ કે મુશ્કેલરૂપ ન થાય તે રીતે વપરાશ કરવાનો રહેશે.
- (૬) મંજૂર થયેલ બિલ્ડ-અપ, એફ. એસ. આઈ., હાઈટ, માર્જીન, પાર્કિંગ, કોમન પ્લોટ, ઓપન સ્પેસ વિગેરેમાં મંજૂરી વગર ફેરફાર કરી શકાશે નહીં.
- (૭) પાર્કિંગ માટે ખુલ્લી રાખેલ જગ્યાના ક્ષેત્રફળના માપ કે ઉપયોગમાં કોઈ ફેરફાર કરવાનો રહેશે નહીં.
- (૮) હાલે સ્થળ ઉપરના હયાત માર્જીન, સ્ટેરકેશ, લીફટ, કોમન પ્લોટ વિગેરે જેવા સહિયારા વપરાશ માટે મંજૂર થયેલ પ્લાનમાં દર્શાવેલ તમામ ખુલ્લી જગ્યા કે બાંધકામવાળી જગ્યાના માપમાં કે ઉપયોગમાં કોઈ ફેરફાર કરવાનો રહેશે નહીં.
- (૯) આ પ્રમાણપત્રથી બાંધકામની તેમજ બાંધકામ માટે વપરાયેલ માલ-સામાનની ગુણવત્તા પ્રમાણીત કરવામાં આવતી નથી અને તે અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કોઈ જવાબદારી રહેતી નથી કે રહેશે નહીં.
- (૧૦) આ પ્રમાણપત્રથી બાંધકામના સ્ટ્રક્ચરલ સ્ટેબીલીટી કે સ્ટ્રક્ચરલ સ્ટ્રેન્થ ગુણવત્તા પ્રમાણીત કરવામાં આવતી નથી અને તે અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કોઈ જવાબદારી રહેતી નથી કે રહેશે નહીં.
- (૧૧) ઉપરના કોઈપણ શરતો નો ભંગ થયેથી આ વપરાશનું પ્રમાણપત્ર આપોઆપ રદ થયેલ ગણાશે અને તે માટે કોઈ અલગ નોટીસ આપવામાં આવશે નહીં તેમજ કાયદા મુજબ જરૂરી પગલાં ભરવામાં આવશે.

આપનું મંજૂર કરાવેલ બાંધકામ પૂર્ણ થયાની તારીખ : ૦૬/૦૩/૧૮ ની અરજી નં : BU/E2/1803/11098

ઉપરોક્ત રેકૉર્ડ નંબરથી મંજૂર થયેલ પ્લાનમાં દર્શાવ્યા મુજબનો ઉપયોગ કરવાની શરતે અને આપને આપવામાં આવેલ સદરહુ બાંધકામ કરવાના આરંભ પ્રમાણપત્ર નં. 02387/1905/4/A1926/R1/M તારીખ : ૦૬-૧૦-૨૦૧૪ માં જણાવેલ શરતો સંદર્ભે નીચે દર્શાવ્યા મુજબ સદરહુ બાંધકામને સાથેના કમ્પ્લીશન પ્લાનમાં દર્શાવ્યા મુજબ વાપરવાની પરવાનગી આપવામાં આવે છે. કમ્પ્લીશન પ્લાન તથા બી. યુ. પરમીશનની લેમીનેટેડ કોપી સ્થળ ઉપર ચોંટાડવાની શરતે આપવાવાની આપવામાં આવે છે.

(૧) મંજૂર થયેલ ઉપયોગ :


માળ	ઉપયોગ	મંજૂર કરેલ બાંધકામનું ક્ષેત્રફળ (ચો.મી.)	વાસની સંખ્યા	
			રહેણાંક	બીન રહેણાંક
બીજું બોયર	-	-	-	-
પ્રથમ બોયર	-	-	-	-
હોલો પ્લીન્થ	-	-	-	-
ગ્રાઉન્ડ ફ્લોર	૨ હેક્ટાર	૬૬૬.૫૬	૧૦	-
પ્રથમ માળ	"	૬૬૬.૫૬	-	-
બીજો માળ	"	૬૬૬.૫૬	-	-
ત્રીજો માળ	-	-	-	-
ચોથો માળ	-	-	-	-
સ્ટેરકેશન + લિફ્ટ મશીન રૂમ	-	-	-	-
કુલ	-	૧૬૬૭.૭૧	૧૦	-

પાર્કિંગની જોગવાઈની વિગત તથા લોકેશન :

પ્રથમ બોયરામાં :
બીજા બોયરામાં :
હોલો પ્લીન્થમાં :
સી.પી. માં :

અંકર ગ્રાઉન્ડ/ઓવરહેડ વોટર ટેંકની વિગત :
તથા લોકેશન :
દરેક દિશાના માર્જીનની વિગત :
કોમન પ્લોટની વિગત :
તથા લોકેશન :
કોન્ટ્રી ક્લબ ૨૯૧૧માં દર્શાવ્યા મુજબ
કોન્ટ્રી ક્લબ ૨૯૧૧માં દર્શાવ્યા મુજબ
કોન્ટ્રી ક્લબ ૨૯૧૧માં દર્શાવ્યા મુજબ
કોન્ટ્રી ક્લબ ૨૯૧૧માં દર્શાવ્યા મુજબ

ટા.ડે.સબ.ઈ. ૦૨/૦૬/૧૮ (નામ : ગરુડ પટેલ)
લેનારની સહી તથા વિગત : Rajiv Patel
ટા.ડે.સબ.ઈ. ૦૨/૦૬/૧૮ (નામ : સુરુષ પટેલ)
ટા.ડે.સબ.ઈ. ૦૨/૦૬/૧૮ (નામ : સી.ડી.ડી.ઓ.)
ટા.ડે.સબ.ઈ. ૦૨/૦૬/૧૮ (નામ : સી.ડી.ડી.ઓ.)
ટા.ડે.સબ.ઈ. ૦૨/૦૬/૧૮ (નામ : સી.ડી.ડી.ઓ.)
ટા.ડે.સબ.ઈ. ૦૨/૦૬/૧૮ (નામ : સી.ડી.ડી.ઓ.)





અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન

મહાનગર સેવા સદન, અમદાવાદ

બી.યુ.પરમીશન લોરાર્થઝ મકાન

બુક નંબર : 196

પાના નંબર : 30

નગર વિકાસ ખાતુ

જીન. પૂર્વ (ધી બોમ્બે પ્રોવીન્સીયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ, ૧૯૪૮ ના શીડ્યુલ 'એ' ના ચેપ્ટર ૧૨ ના રૂલ ૮/બ/૧ તથા જી.ડી.સી.આર. ૭ મુજબ વાપરવાની પરવાનગી)
વોર્ડ નંબર : ૧૧ હાલના સરનામું : ડી. હરજીભાઈ મહેતા ભવન, સી.આર. ૧૨૧૨ જાગર ૨૧૨ હસ્તા, પિંડી ૨૦૨૧૨, અમદાવાદ, તારીખ : ૦૩/૦૬/૨૦૧૮

રેકર્ડ નંબર : BLNTI/E2/0909/4/CDR/ARF80/R0/M
માલિકનું નામ : અરુણ કી. પંચપતિ પારેજી સોનિ સોનિ કિલ્લો
સરનામું : ૧૧, સુ. રામાઈ હોમ, સી.આર. ૨-૧૨૦૦ પાલિકા
ગા. મકાલ, અમદાવાદ

T.P.S. No. 115-332 F.P. No. 5311+741 S.P. No./Tena./Block No. ---
Village સી.આર. ૧૨૧૨ R.S. No. 184/1+286/1 Block No. "D"
Gramtal --- C.S. No. --- Sheet No. ---

(૧) સોસાયટી/એસોસીએશન : સુ. રામાઈ સોનિ (૨) બિલ્ડર/રેવલપરનું નામ : ---
સી.આર. ૧૨૧૨ હોમ, સી.આર. ૨-૧૨૦૦
સરનામું : સુ. રામાઈ કોલો સરનામું : ---
ગા. અમદાવાદ શહેર પાલિકા
અમદાવાદ
(૩) એન્જીનીયરનું નામ : ડી. પંચપતિ (૪) આર્કીટેક્ટનું નામ : ---
ડી. અરુણ કી. પંચપતિ
લાયસન્સ નં ER-0782100221R લાયસન્સ નં ---
(૫) સ્ટ્રક્ચરલ ડીઝાઇનરનું નામ : જી.એ.ડી. કી. પંચપતિ (૬) કલાર્ક ઓફ વર્કસનું નામ : ફિજી કી. પંચપતિ
ડી. અમદાવાદ શહેર પાલિકા ડી. સી.આર. ૨-૧૨૦૦, અમદાવાદ
લાયસન્સ નં CD-0349200221R લાયસન્સ નં CD-0559020419

શરતો :-

- જનરલ રેવલપમેન્ટ કન્ટ્રોલ રેગ્યુલેશનના વિનિયમ નં. ૨૬ની જોગવાઈ અનુસાર ઈમારતની સાચવણી, જાળવણી અને મરમત વખતે વખત કરવાની શરતે વપરાશનું પ્રમાણપત્ર આપવામાં આવે છે.
- પ્રવર્તનમાન અથવા જે તે સમયના કાયદા અન્વયે ભરવાના થતા કરવેરા ભરવાના રહેશે.
- ભવિષ્યમાં સદરહુ વિસ્તારની નગર રચના હેઠળ જમા કરવાની થતી નેટ રીમાન્ડની રકમ, ડ્રેનેજ ચાર્જ તથા અન્ય ફી, ડીપોઝીટ જમા કરાવવાની રહેશે.
- વપરાશના હેતુમાં ફેરફાર કરતાં પહેલાં પૂર્વ મંજૂરી લેવાની રહેશે.
- આ બાંધકામનો વપરાશ પર્યાવરણને હાનિકારક અને ઉપદ્રવકારી ન થાય તેમજ આસ-પાસના વિસ્તાર અને વિસ્તારના રહીશોને અસુવિધારૂપ કે મુશ્કેલરૂપ ન થાય તે રીતે વપરાશ કરવાની રહેશે.
- મંજૂર થયેલ બિલ્ડ-અપ, એફ. એસ. આઈ., હાઈટ, માઈન, પાર્કિંગ, કોમન પ્લોટ, ઓપન સ્પેસ વિગેરેમાં મંજૂરી વગર ફેરફાર કરી શકાશે નહીં.
- પાર્કિંગ માટે ખુલ્લી રાખેલ જગ્યાના ભોજનના માપ કે ઉપયોગમાં કોઈ ફેરફાર કરવાનો રહેશે નહીં.
- હાલે સ્થળ ઉપરના હયાત માઈન, સ્ટેરકેશ, લીફ્ટ, કોમન પ્લોટ વિગેરે જેવા સહિયારા વપરાશ માટે મંજૂર થયેલ પ્લાનમાં દર્શાવેલ તમામ ખુલ્લી જગ્યા કે બાંધકામવાળી જગ્યાના માપમાં કે ઉપયોગમાં કોઈ ફેરફાર કરવાનો રહેશે નહીં.
- આ પ્રમાણપત્રથી બાંધકામની તેમજ બાંધકામ માટે વપરાયેલ માલ-સામાનની ગુણવત્તા પ્રમાણીત કરવામાં આવતી નથી અને તે અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કોઈ જવાબદારી રહેતી નથી કે રહેશે નહીં.
- (૧૦) આ પ્રમાણપત્રથી બાંધકામના સ્ટ્રક્ચરલ સ્ટેબીલીટી કે સ્ટ્રક્ચરલ સ્ટ્રેન્થ ગુણવત્તા પ્રમાણીત કરવામાં આવતી નથી અને તે અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કોઈ જવાબદારી રહેતી નથી કે રહેશે નહીં.
- (૧૧) ઉપરના કોઈપણ શરતો નો ભંગ થયેથી આ વપરાશનું પ્રમાણપત્ર આપોઆપ રદ થયેલ ગણાશે અને તે માટે કોઈ અલગ નોટીસ આપવામાં આવશે નહીં તેમજ કાયદા મુજબ જરૂરી પગલાં ભરવામાં આવશે.

આપનું મંજૂર કરાવેલ બાંધકામ પૂર્ણ થયાની તારીખ : ૦૬/૦૩/૧૮ ની અરજી નં : ---
BLI/21/80317/1100 ના સંબંધમાં જણાવવાનું કે,
ઉપરોક્ત રેકર્ડ નંબરથી મંજૂર થયેલ પ્લાનમાં દર્શાવ્યા મુજબનો ઉપયોગ કરવાની શરતે અને આપને આપવામાં આવેલ સદરહુ બાંધકામ કરવાના આરંભ પ્રમાણપત્ર નં. 02329/0909/4/ARF80/R0/M
તારીખ : ૦૬-૧૦-૨૦૧૪ માં જણાવેલ શરતો સંદર્ભે નીચે દર્શાવ્યા મુજબ સદરહુ બાંધકામને સાથેના કમ્પ્લીશન પ્લાનમાં દર્શાવ્યા મુજબ વાપરવાની પરવાનગી આપવામાં આવે છે. કમ્પ્લીશન પ્લાન તથા બી. યુ. પરમીશનની લેમીનેટેડ કોપી સ્થળ ઉપર ચોટાડવાની શરતે આ પરવાનગી આપવામાં આવે છે.

(૧) મંજૂર થયેલ ઉપયોગ :

માળ	ઉપયોગ	મંજૂર કરેલ વાંધકામનું ભોજન (ચો.મી.)	વાસની સંખ્યા	
			રહેણાંક	બીન રહેણાંક
બીજું ભોજન	---	---	---	---
પ્રથમ ભોજન	---	---	---	---
હોલો પ્લીન્થ	---	---	---	---
ગ્રાઉન્ડ ફ્લોર	મિડયુટી ૨૨	૧૫.૦૬	---	---
પ્રથમ માળ	સેમિગ્રી ફોલ	૩૪.૫૩	---	---
બીજો માળ	---	---	---	---
ત્રીજો માળ	---	---	---	---
ચોથો માળ	---	---	---	---
સ્ટેર કેલિન + લિફ્ટ થીન રૂમ	---	---	---	---
કુલ	---	૫૯.૫૯	---	---

પાર્કિંગની જોગવાઈની વિગત તથા લોકેશન :

પ્રથમ ભોજનમાં : મંજૂર થયેલ ૨૨ માળના દર્શાવ્યા મુજબ
બીજા ભોજનમાં : ---
હોલો પ્લીન્થમાં : ---
સી.પી. માં : ---

અંદર ગ્રાઉન્ડ/ઓવરહેડ વોટર ટેંકની વિગત : --- કોમન પ્લોટની વિગત : મંજૂર થયેલ ૨૨ માળના દર્શાવ્યા મુજબ
તથા લોકેશન : મંજૂર થયેલ ૨૨ માળના દર્શાવ્યા મુજબ તથા લોકેશન : દર્શાવ્યા મુજબ
દરેક દિશાના માઈનની વિગત : ઉત્તર : મુજબ દક્ષિણ : --- પૂર્વ : --- પશ્ચિમ : ---
મંજૂર થયેલ ૨૨ માળના દર્શાવ્યા મુજબ

ડા.ડે.સંખ.ઈ.

(નામ : અરુણ પંચપતિ)

લેનારની સહી તથા વિગત : ---

ડા.ડે.સંખ.ઈ.

(નામ : મહુલ પંચપતિ)

ડા.ડે.સંખ.ઈ.

(નામ : અરુણ પંચપતિ)

ડા.ડે.સંખ.ઈ.

(નામ : અરુણ પંચપતિ) (નામ : ---)

આસી. મ્યુનિસિપલ કમિશનર (---)